

સૂચનાઓ :

- આવકવેરા ધારો 1961 ની કલમ 10(10ડી) હેઠળ માફી પાત્ર ન હોય એવી ચુકવણીઓ પર 2% ટીડીએસ કપાત પાત્ર રહેશે.
- *જો પેન ન જણાવ્યો હોય તો ટીડીએસ નો દર 20% રહેશે.
- ^એનઆરઆઈ માટે ટીડીએસનો દર રૂ. 1 કરોડ સુધીની ચુકવણી માટે 30.9% અને રૂ. 1 કરોડથી વધુની ચુકવણી માટે 33.99% રહેશે.

એસબીઆઈ લાઈફ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડ,

તારીખ :

દિ	દિ	મ	મ	વ	વ	વ
----	----	---	---	---	---	---

શાખા _____

પ્રિય શ્રીમાન/શ્રીમતી,

સંદર્ભ : ધન રક્ષા/સુપર સુરક્ષા/રિન્નરક્ષા પોલિસી (કોઈ એક પર નિશાન કરો) હેઠળ લોન અકાઉન્ટ નંબર _____
_____ નું ફોરકલોઝ/સરન્ડર.

મેં _____ ના રોજ (લોન બંધ કર્યાની તારીખ) લોન બંધ કરી (ફોરકલોઝ) છે અને સૂચિત લોન અકાઉન્ટ આજ રોજ મુજબ બંધ છે. હું આપને પોલિસી ફોરકલોઝ/સરન્ડર કરવા અને પ્રોડક્ટ્સના નિયમો અને શરતો અનુસાર સરન્ડર રકમ પાછી ચુકવવા વિનંતી કરું છું.

☐ પેન કાર્ડની કૉપી પેન*

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

રહેણાંક સ્થિતિ : ☐ નિવાસી ☐ એનઆરઆઈ^ ☐ રહેઠાણનો દેશ

આભાર સહ,

મેમ્બર(રો) નું નામ : _____

મેમ્બર(રો) ની સહી

તારીખ :

દિ	દિ	મ	મ	વ	વ	વ
----	----	---	---	---	---	---

 સ્થળ : _____**બેંકર તરફથી કરાચેલી ભલામણ**લોન અકાઉન્ટ નંબર _____ (નવો નંબર)/ _____ (જૂનો નંબર)
ધન રક્ષા એસપી/ધનરક્ષા એલપીપીટી/સુપર સુરક્ષા/રિન્નરક્ષા હેઠળ આવરી લેવાયેલ હતી. લોન અકાઉન્ટ _____ ના રોજ બંધ કરવામાં (ફોરકલોઝ) આવ્યું છે.

ઓરિજિનલ સર્ટિફિકેટ ઑફ ઇન્શ્યૂરન્સ આ સાથે જોડાયું છે/નથી પ્રાપ્ત થયું (કોઈ એક પર નિશાન કરો). મેમ્બર દ્વારા પોલિસી સરન્ડર કરવા સામે અમને કોઈ વાંધો નથી.

બ્રાન્ચ મેનેજરનું નામ : _____

બ્રાન્ચ મેનેજરની સહી

બેંક બ્રાન્ચનું નામ : _____

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

બ્રાન્ચ કોડ :

બેંકનો સિક્કો :

તારીખ :

દિ	દિ	મ	મ	વ	વ	વ
----	----	---	---	---	---	---

ડાયરેક્ટ કેડિટ મેન્ડેટ

પ્રતિ

એસબીઆઈ લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ

શાખા : _____

વિષય : એનઈએફટી મારફત પોલિસી પેમેન્ટ મેળવવા બાબત

હું એનઈએફટી મારફત પોલિસી પેમેન્ટ મેળવવા મારા બેંક એકાઉન્ટની નીચે જણાવેલી વિગતો પૂરી પાડું છું.

લોન એકાઉન્ટ નંબર	
પોલિસીધારકનું નામ	
બેંકનું નામ	
બેંક શાખાનું સરનામું	
એકાઉન્ટનો પ્રકાર (કૃપા કરી યોગ્ય હોય તેના પર ☒ કરો)	☐ સેવિંગ્સ ☐ કરન્ટ ☐ #એનઆરઈ
બેંકનું એકાઉન્ટ નંબર	
આઈએફએસ કોડ	
મોબાઈલ નંબર	
ઈ-મેઈલ આઈડી	

#એનઆરઈ એકાઉન્ટ માટે ચુકવણી સીધી ખાતામાં જમા કરવા બેંક તરફથી પત્ર આવશ્યક રહે છે.

મેં આ સંદર્ભે નીચે જણાવેલા દસ્તાવેજો સાથે જોડ્યા છે (કૃપા કરી યોગ્ય હોય તેના પર ☒ કરો)

- ☐ પ્રીપ્રિન્ટેડ નામ અને એકાઉન્ટ નંબર ધરાવતું ઓરિજિનલ ચેક પાનું.
- ☐ જો ચેક પર પ્રીપ્રિન્ટેડ નામ ન હોય તો કૃપા કરી બેંક પાસબુકની સ્વપ્રમાણભૂત કરેલી કૉપી રજુ કરો જે પ્રીપ્રિન્ટેડ બેંક એકાઉન્ટ નંબર, એકાઉન્ટધારકનું નામ અને આઈએફએસ કોડ સહિત તાજેતરના ટ્રાન્ઝેક્શનોની (1 મહિનાથી વધુ જૂના નહીં) પ્રત દર્શાવતી હોય.

હું સહમત થાઉં છું કે :

1. એનઆરઈ એકાઉન્ટ માટે સરન્ડરની રકમ સીધી ખાતામાં જમા કરવા બેંક તરફથી પત્ર આવશ્યક રહે છે.
2. એસબીઆઈ લાઈફ તમારા ખાતામાં ભૂલથી કરાયેલ કોઈપણ ચુકવણી રિવર્સ કરવાનો તેમ જ તમારા ખાતામાં જમા કરાયેલી આવી વધારાની કોઈપણ રકમ વસૂલ કરવા ધારણાધિકાર (લીયન) લાગુ કરવાનો અધિકાર અબાધિત રાખે છે.
3. એસબીઆઈ લાઈફ એનઈએફટી મારફત પેઆઉટ ન કરી શકાય એ કિસ્સામાં ચેક મારફત રકમ ચુકવવાનો અધિકાર અબાધિત રાખે છે.

“હું આ દ્વારા ઘોષિત કરું છું કે મેં અહીં ઉપર પૂરી પાડેલી પોલિસીની વિગતો અને બેંક એકાઉન્ટની વિગતો સાચી અને ખરી છે તેમ જ હું આ દ્વારા એસબીઆઈ લાઈફને ઉપર જણાવેલ પોલિસી અંતર્ગત પાકતી રકમ મારા ઉપર જણાવેલા બેંક ખાતામાં મારા સંપૂર્ણ જોખમને આધીન જમા કરવા અધિકૃત કરું છું.”

તારીખ : / /

સ્થળ : _____

પોલિસીધારકની સહી